

4 OCTOBER 1960

Because Thou art All-beauty and All-bliss,
My soul blind and enamoured yearns for Thee;
It bears Thy mystic touch in all that is
And thrills with the burden of that ecstasy.

Behind all eyes I meet Thy secret gaze
And in each voice I hear Thy magic tune:
Thy sweetness haunts my heart through Nature's ways;
Nowhere it beats now from Thy snare immune.

It loves Thy body in all living things;
Thy joy is there in every leaf and stone;
The moments bring Thee on their fiery wings;
Sight's endless artistry is Thou alone.

Time voyages with Thee upon its prow
And all the future's passionate hope is Thou.

25.10.1939

Sri Aurobindo

૪ ઓક્ટોબર ૧૯૬૦

(મહાલક્ષ્મી)

(પૃથ્વી છંદ)

અહો તું સહુ રૂપ-રૂપ, રહી સર્વ આનંદ તું,
ત્વદર્શ મુજ અંધ આત્મ મતિ-મુગ્ધ ઝૂંચા કરે,
મળે તવ સુગુહ સ્પર્શ પ્રતિ વસ્તુમાં તેહને
અને પુલકતો જ તેહ અતિ એ મુદા-ભારથી.

બધાં નયન પૂઠ ગૂઢ તવ દૃષ્ટિ લાઘે મને,
હરેક સ્વર મધ્ય સૂર તવ સાંભળું અદ્ભુત:
ઉરે પ્રકૃતિ-પંથથી રણકતી જ તવ માધુરી,
ન ક્યાંય ધબકત એ થઈ વિમુક્ત તવ જાળથી.

સજીવ સહુ વસ્તુ માંહા તુજ દેહ એ ચાહતું,
વસ્યો છ તવ હર્ષ તેહ પ્રતિ પર્ણમાં, પથ્થરે :
પળો વહતી હા તને જ નિજ અઙ્ગિ-પાંખો પરે,
કળા દૃગની હા અનંત બસ એકલી તું રહી.


તને જ નિજ નાવ-અગ્ર ધરી કાળ યાત્રા કરે
અને અખિલ ભાવિની પ્રખર આશ તું તો રહે.

૨૫.૧૦.૧૯૩૯

('લાસ્ટ પોએમ્સ')

શ્રી અરવિન્દ

અનુવાદ: સુન્દરમ્



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2020
SEPTEMBER
૧ સપ્ટેમ્બર, ૨૦૨૦

— PUJA-DAY MESSAGES —

This month we give some Puja-Day messages given in the Past.

— પૂજા દિવસોના સંદેશ —

ભૂતકાળમાં, પૂજાના દિવસો ઉપર અપાયેલા સંદેશામાંથી થોડાક આ
મહિને આપીએ છીએ.

*The supramental force
has the power to transform
even the darkest hate
in luminous peace -
with my blessings*

11 October, 1954

The supramental force has the power to transform
even the darkest hate into luminous peace.

With my blessings
- The Mother

૧૧ ઓક્ટોબર, ૧૯૫૪

અતિમાનસ શક્તિમાં કાળામાં કાળા ઘિસ્કારને તેજોમય શાંતિમાં ફેરવી
નાખવાનું બળ છે.

મારા આશીર્વાદ સાથે
- શ્રી માતાજી

This is a reprint of August, 1990 Prosperity. આ પ્રોસ્પેરિટી ઓગસ્ટ, ૧૯૯૦ નું પુનર્મુદ્રણ છે.

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ☎ 0413-2331470

રવાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨ ☎ ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • Sept 2020

<https://themothersprosperity.org>

*Every obstacle must
disappear, in every part
of the being, the darkness
of the ignorance must
be replaced by the Divine's
knowledge
With my blessings*

12 October, 1954

**Every obstacle must disappear, in every part
of the being, the darkness of the ignorance
must be replaced by the Divine's knowledge.**

With my blessings
- The Mother

૧૨ ઓક્ટોબર, ૧૯૫૪

એકેએક વિઘ્ન અદૃશ્ય થઈ જવું જોઈએ, સ્વરૂપના દરેક ભાગમાંથી,
અજ્ઞાનના અંધકારને બદલે પ્રભુનું જ્ઞાન મુકાવું જોઈએ.

મારા આશીર્વાદ સાથે
- શ્રી માતાજી

(શ્રી માતાજીના મંત્રો)

“Mantras of The Mother”

— આશિષ પ્રસાદ —



પૂજા દિ-નો
28 SEPTEMBER 1960

MOTHER DURGA! From age to age, in life after life, we come down into the human body, do thy work and return to the Home of Delight. Now too we are born, dedicated to thy work, *Listen, O Mother, descend upon earth, come to our help.*

MOTHER DURGA! We are thy Children, through thy grace, by thy influence may we become fit for the great work, for the great Ideal, Mother, destroy our smallness, our selfishness, our fear.

Sri Aurobindo

૨૮ સપ્ટેમ્બર, ૧૯૬૦

(દુર્ગાષ્ટમી)

મા દુર્ગા ! યુગે યુગે, જન્મે જન્મે, અમે માનવ શરીરમાં આવીએ છીએ, તારું કાર્ય કરીએ છીએ અને આનંદના ધામમાં પાછા ચાલી જઈએ છીએ. આ સમયે પણ અમે જન્મ લીધો છે, તારા કાર્ય પ્રત્યે સમર્પિત થઈને. સાંભળ, હે માતા, પૃથ્વી ઉપર નીચે આવ, અમારી સહાયે આવ.

મા દુર્ગા ! અમે તારાં સંતાનો છીએ, તારી કૃપા દ્વારા, તારા પ્રભાવ દ્વારા તારા મહાન કાર્ય માટે, મહાન આદર્શ માટે અમે યોગ્ય બનીએ. મા, અમારી અલ્પતાનો નાશ કર, અમારા સ્વાર્થીપણાનો, અમારા ભયનો વિનાશ કર.

શ્રી અરવિન્દ

30 SEPTEMBER 1960

MOTHER DURGA! Enter our bodies in thy Yogic strength. We shall become thy instruments, thy sword slaying all evil, thy lamp dispelling all ignorance. Fulfil this yearning of thy young children, O Mother. Be the master and drive thy instrument, wield thy sword and slay the evil, hold up the lamp and spread the light of knowledge. Make thyself manifest.

MOTHER DURGA! When we possess thee, we shall no longer cast thee away; we shall bind thee to us with the tie of love and devotion. Come, Mother, manifest thyself in our mind and life and body.

Come, Revealer of the hero-path. We shall no longer cast thee away. May our entire life become a ceaseless worship of the Mother, all our acts a continuous service to the Mother, full of love, full of energy. This is our prayer, O Mother, descend upon earth, make thyself manifest in this land of India.

Sri Aurobindo

૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૦

(વિજ્યાદશમી)

મા દુર્ગા ! અમારાં શરીરોમાં તારું યોગબળ લઈને પ્રવેશ કર. અમે તારાં કરણો બનીશું, સર્વ અશુભને કતલ કરતી તારી અસિ બનીશું, સર્વ અજ્ઞાનને વિખેરી નાખતો તારો દીપક બનીશું. તારાં યુવાન સંતાનોની આ અભિલાષા પૂર્ણ કર, હે મા. તું સ્વામિની બન અને તારા કરણને ચલાવ, તારી અસિને ધુમાવ અને અશુભનો વિનાશ કર, દીપકને ઊંચે ઉઠાવ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ.

મા દુર્ગા ! તને પામ્યા પછી, હવે અમે તારું વિસર્જન કરીશું નહિ. પ્રેમ અને ભક્તિના દોરે તને બાંધી રાખીશું. આવ, મા, અમારા મનમાં અને જીવનમાં અને શરીરમાં તારો પોતાનો અવિભાવ કર.

આવ, હે વીરમાર્ગને દર્શિત કરનારી ! હવે તારું વિસર્જન કરીશું નહિ. અમારું સકલ જીવન માની એક અખંડ પૂજા બનો, અમારાં સકલ કર્મો, પ્રેમથી સભર, શક્તિથી સભર, માની એક અસ્ખલિત પૂજા બની રહો. આ અમારી પ્રાર્થના છે, હે મા, પૃથ્વી ઉપર અવતરણ કર, ભારતના આ દેશમાં તારો પોતાનો અવિભાવ કર.

શ્રી અરવિન્દ